

01st November, 2022

To,
Corporate Relations Department **BSE Limited**2nd Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai-400 001

To,
Corporate Relations Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Plot No. C/1, G-Block,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai – 400 051.

Scrip Code : 532760

Symbol: DEEPENR

Dear Sir/Madam

Sub: Disclosure under Regulation 30 read with Part A of Schedule III and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015-Newspaper Advertisement for transfer of Equity Shares to IEPF Authority.

In terms of Regulation 30 read with Part A of Schedule III and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of Newspaper Advertisement published in the Business Standard – English and Jai Hind – Gujarati on 01st November, 2022 in respect of notice to the shareholders for transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund Authority (IEPF Authority).

You are requested to take the same on your record.

Yours Faithfully,

For, Deep Energy Resources Limited (Formerly known as Deep Industries Limited)

Premsingh Sawhney

Chairman & Non Executive Director

DIN: 03231054

of 5 min each).

(up to 5.30.P.M)

IDFC FIRST

Bank

PUBLIC NOTICE

(Under paragraph 21(2) of the Drugs Price Control Order, 2013) Name of the Company - Kedrion Biopharma India Private Limited Registered office Address - House NO. R-265 C, Ground Floor Greater Kailash Part -1, New Delhi -48 CIN No. U52100DL2013FTC261763; Website: Kedrion.com

E- Mail: vlpkedrion@gmail.com; Phone No. 99798 55266 Attention of public is drawn to the fact that Kedrion Biopharma India Private Attention of public is drawn to the lact that Neorion biopharmal india Private Limited having registered office at aforesaid address is importing/marketing formulations namely (i) RhoGAM (Human Anti –D Immunoglobulin 300mcg), (ii) AIMAFIX (Human Plasma Coagulation factor IX), (iii) EMOCLOT (Human Plasma Coagulation factor VIII), (iv) IMMUNORHO (Human Anti-D Immunoglobulin) 300mcg/Vial), (v) IMMUNOHBS (Human Hepatitis B Immunoglobulin), (vi) TETANUS GAMMA (Human Tetanus Immunoglobulin) (hereinafter referred to as

stop the Importing/Marketing of the above said product as per the Instructions of NPPA, after a period of twelve months i.e. 16th May, 2023, from the date of prior notice published on 16th May, 2022. After discontinuation of the above medicine, the same may not be available in the market. Therefore, patients using such medicine may consult their doctor for prescribing alternate medicine. All the doctors /Medical Personals may also

medicine) Kedrion Biopharma India Private Limited wants to discontinue and

Name of the Company Authorised Person - Ritesh Prakash Adatiya Designation – Liquidator Name of the Company – Kedrion Biopharma India Private Limited Date: 01/11/2022

ADITYA BIRLA CAPITAL

Place: Ahmedabac

Aditya Birla Housing Finance Limited

APPENDIX IV[See Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002] POSSESSION NOTICE(for Immovable Property)

, the undersigned being the authorized officer of Aditya Birla Housing Finance Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers con ferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement Rules, 2002 issued a demand notice Dated 11.09.2021 calling upon the borrowers Nirmaladevi Harilal Prajapati And Harilal Ramsarikha Prajapati to repay the amount mentioned in the notice being INR 4,79,848.59/- (Rupees Four Lakh(s) Seventy Nine Thousand Eight Hundred Forty Eight And Paise Fifty Nine Only within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of the powers conferred on him/her under Section 13(4) of the said act read with rul8 the Security Interest (Enforcement) Rules 2002 on this 30th Day of Oct of the year 2022.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Aditya Birla Housing Finance Limited for an amount of INR 4,79,848.59/- (Rupees Four Lakh(s) Seventy Nine Thousand Eight Hundred Forty Eight And Paise Fifty Nine Only) and interest thereon. Borrowers attention is invited to the provisions of sub-section 8 of Section 13 of the act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property All that part and parcel of the property consisting of Plot no 217, Sub plot no 217/3, Shrinathji park, Block no 3, B/H Bharat petrol pump, Off Gate no 2, Kalawad road

metoda GIDC, Rajkot, Gujarat, India- 360021" Date: 30/10/2022 Place: Rajkot Authorised Office Aditya Birla Housing Finance Limited



यूको बैंक 🙀 uco ванк Mid Corporate Branch, Surat Ankur Char Rasta, Varachha, Surat. Ph : 02612540362 Email: Surmcc@ucobank.co.in.

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) [Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002]

Whereas, the undersigned being the Authorised Officer of the UCO BANK under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002, issued a **Demand Notice** dated 16.07.2022 and calling upon the Borrower(s) M/s. Happy Home Infratech, Partner: Nishant G. Panchal, Partner: Vipul Jasmatbhai Golakiya Partner: Happy Home Corporation Pvt. Ltd and the Guarantors Nishant G. Panchal (Personal Guarantee), Vipul Jasmatbhai Golakiya (Personal Guarantee), M/s Happy Home Corporation Pvt. Ltd. (Corporate Guarantee) to repay the amount mentioned in the notice, being Rs.2.47,25.290.02 (Rupees Two crores forty seven lakhs twenty five thousand two hundred ninety and paisa two only) as on 29.06.2022 (inclusive of interest up to 31-05-2022) and excluding future interest, legal charges, other costs & incidental charges thereon, within 60 days from the date of receipt of the said notice.

The borrower/ Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 31st day of October of the year 2022.

The borrower/ Guarantor(s) in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of UCO Bank for an amount of Rs.2,47,25,290.02 (Rupees Two crores forty seven lakhs twenty five thousand two hundred ninety and paisa two only) plus applicable charges and interest thereon. The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

Unsold Inventory Unit No.-A-21, Area 148.55 Sq. Mtrs. and Unit No.-C-41, Area 148.55 Sq. Mtrs. (1) Exclusive charge by way of registered equitable mortgage by deposit of

original title deeds of the land & building situated at block no 237, FP No 99 TP survey no 37, Near Atlanta shopping mall, Althan- Bhimarad Canal Road, A) Unit No.-A-21, Area 148.55 Sq. Mtrs., situated at "Nest Venezia" block no

237, FP No 99, TP survey no 37, Near Atlanta shopping mall, Althan-Bhimarad Canal Road, Althan, Surat. (B) Unit No.-C-41, Area 148.55 Sq. Mtrs., situated at "Nest Venezia" block no

237, FP No 99, TP survey no 37, Near Atlanta shopping mall, Althan-Bhimarad Canal Road, Althan, Surat.

Date: 31/10/2022 | Place: Surat Authorised Officer, Uco Bank

DEEP ENERGY RESOURCES LIMITED

CIN: 163090G.11991P1C014833 Regd Office: 12A & 14 Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad, 380 058, PPh, 02717-298510 Fax: 02717-298520

E-mail:info@deepenergy.ooo Website: www.deepenergy.ooo NOTICE (For the attention of Equity Shareholders of the Company) Sub: Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund Authority (IEPF Authority)

This notice is being given pursuant to the provisions of section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") as notified from time to time by the Ministry of Corporate Affairs (MCA). As per the rules notified by the MCA recently, the Company needs to transfer the Equity Shares of Rs. 10/- each held by the Shareholders either in physical form or demat mode to the Investor Education and Protection Fund Authority (IEPF Authority) in respect of which dividend has not been paid or claimed for sever

consecutive years or more. Adhering to the various requirements set out in the Rules, the Company has already communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF authority under the said Rules for taking appropriate action(s).

For claiming unpaid/unclaimed dividend, the concerned shareholders may contact on or before 3rd December, 2022 to the Company's Registrar & Transfer Agent at M/s Link Intime India Pvt. Ltd., 5th Floor, 506 to 508 Amarnath Business Centre-1 (ABC-1), Beside Gala Business Centre, Nr St. Xavier's College Corner, Off C G Road, Ellis bridge Ahmedabad - 380006, Tel No.: 079-26465179, e-mail: iepf.shares@linkintime.co.in.

Please note that the Company will take necessary action for the issue of duplicate share certificate(s) and the original share certificate(s) which stand registered in the name(s) of the Shareholders in physical form will be deemed cancelled/non-negotiable and the share will be credited in favour of Investor Education and Protection Fund Authority (IEPF Authority) through Corporate

Action as required under the aforesaid Rules. The concerned shareholders may note that, upon such transfer, they can claim the said shares along with dividend(s) from IEPF Authority details of which are

available at www.ienf.gov.in. Special Window Facility for Senior-Citizens of age 75 Years & above

Place : Ahmedabad

Date: 01-11-2022

Investor Education and Protection Fund Authority as a part of Azadi Ka Amrit Mahotsav (AKAM) has launched a special window facility for senior citizens of age 75 years & above. As a part of this facility, the claim filed by these claimants shall be auto-prioritized in MCA 21 system after receipt of e-verification report from the companies.

For facilitation of these claimants, a dedicated telephone numbe 011-23441727 and email id seniorcitizen.iepfa@mca.gov.in has beer established By Order of the Board

For Deep Energy Resources Limited (Formerly known as Deep Industries Limited) Shail Savla, Managing Directo

EDELWEISS HOUSING FINANCE LTD.

Registered Office Situated At Tower 3, Wing B, Kohinoor City Mall, Kohinoor City, Kirol Road, Kurla (W), Mumbai – 400070

Regional Office Address: - Office 301,302,303,304, 3rd Floor 3rd Eye Vision Opposite Shivalik Plaza, Near IIM, Panjara Pol Ahmedabad -380009



IDFC FIRST

Bank

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT, 2002 Notice is hereby given that the following borrower/s have defaulted in the repayment of principal & interest of the loan faci ities obtained by them from the EHFL and the said loan accounts have been classified as Non-Performing Assets (NPA The Demand notice was issued to them under Section 13(2) of The Securitisation and Reconstruction of Financial Ass and Enforcement of Security Interest Act 2002(SARFAESI Act) on their last known address. In addition to said demai

notice, they have been informed by way of this public notice.

Details of the Borrowers, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and A claimed there under are given as under:

I.Name and Address of the Borrower, Co Borrower, Guarantor And Loan Amount: RAMSINGH MALARAM JANGID (BORROWER) & POOJA RAMSINGH (CO - BORROWER) C-5, Mahavir Complex B/5 Haridham Harivila Parshwnath Township Krihsnanagar Saijpur Bogha Ahmedabad 382345 LAN.NO.: LAHMSTH0000030458 Loan agreement Date: 28.09.2017 Demand Notice Date: 09-SEP-22

LOAN AMOUNT: RS. 14,50,000/- (Rupees Fourteen Lakh Fifty Thousand Only)

Amount Due in: Rs 11,83,136.84/- (Rupees Eleven Lakh Eighty Three Thousand One Hundred Thirty Six and Eight

Details of the Secured Asset: All The Part And Parcel Of The Property Being Flat No. 201 On 2nd Floor, Block H, Vibrant Homes" Block No. 99. Tos No. 75. En No. 38. Sn No. 2. Mouje: Muthiya, Taluka, Asarya, Dist And Sub Distric Ahmedabad (Admeasuring About 84.47 Sq Mtrs) The Said Flat Is Bounded As: North: Open Space South: Flat No. I 202 East: Block I West: Flat No. H 204.

You the above Borrower/S are therefore called upon to make payment of the outstanding dues as mentioned herein above in full Within 60 Days of this Notice failing which the undersigned shall be constrained to take action under the SARFAESI act to enforce the above mentioned securities. Please note that as per Section 13(13) of The Said Act, You are restrained from transferring the above-referred securities by way of sale, lease or otherwise without our conse Sd/- Authorized Office Place: AHMEDABAD FOR EDELWEISS HOUSING FINANCE LIMITED Date: 01.11.2022

IDFC FIRST Bank Limited

erly known as Capital First Home Finance Limited/ Capital First Limited)

Registered Office: - KRM Towers, 7th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031

Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

Authorized Officer – Divyarajsinh Zala | Contact Number – 9274207909 Authorized Officer - Debjyoti Roy | Contact Number - 9874702021

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002 lotice is hereby given to the public in general and in particular to the Borrower (s) acnd Co-Borrower (s) as per column (ii) that the belo described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of erstwhile Capital First Home Finance Limited and Capital First Limited now IDFC FIRST Bank Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as described hereunder, for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Home Finance Limited

and Capital First Limited) For detailed terms and conditions of the sale, please refer to the link provided in IDFC FIRST Bank website i.e. www.idfcfirstbank.com

S. NO	(i) Demand Notice Date and Amount	(ii) Name Borrower (s) and Co-Borrower (s)	(iii) PROPERTY ADDRESS	(iv) Reserve Price Amount	(v) EMD Amount	(vi) Date and Time of Auction	(vii) Date and Time of EMD Auction
1	INR	Jalaram Parotha	All The Piece And Parcel Of The	INR	INR	18th Nov	17th Nov
	37,15,700.2/-	House,	Property Consisting Of All The Piece	23,92,100/-	2,39,210/-	2022	2022
	Demand Notice		And Parcel Of The Property Being A			11.00 to	11.00 to
	Date	Premani, Mr. Sunny	Commercial Office No. 310 On 3Rd			1.00 PM	1.00 PM
	19-10-2019	Janmohmed	Floor Having A Carpet Area 369-15				
		Premani,	Sq Ft I.E. 34-295 Sq Mtrs And Built-				
		Mrs. Narmin Sunny	Up-Area 406-065 Sq Ft. I.E. 37-724				
		Premani, Mr. Milan	Sq Mtrs In "Business Terminal"				
		J Premani &	Situated At The Corner Of Jagnath				
		Mrs. Nasim	Plot Street No. 1 Of Rajkot City				
		Janmahomad	Survey Ward No. 14, Sheet No. 159,				
		Premani	City Survey No. 2055-56 In Sub-				
			Dist. & Dist. Rajkot, Gujarat – 360001				

Disclaimer: Please note that the said notice is issued for sale of immovable property only and IDFC FIRST Bank Limited Sd/ as no right to sale the movable assets, if any, present at the immovable property. Authorized Officer **IDFC FIRST Bank Limite** (Formerly known as Capital First Home Finance Limited/ Capital First Limited) Date: 31.10.2022

Housing Development Finance Corporation Ltd.

HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad. Phone: (079) 66307000

Whereas the Authorised Officer/s of Housing Development Finance Corporation Limited, under Securitisation And Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interesten at the applicable rates as mentioned in the id notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc. till the date of payment and / or realisatio

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.*	Date of Demand Notice	Date of Possession Physical/ Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	MR. KISHOR DAHYALAL GURJAR (Borrower) MRS. VAISHNAVI KISHOR GURJAR (Co-Borrower) Loan A/c No. 648157378 And 653358315	Rs. 26,06,864/- And Rs. 1,17,113/- Respectively As on 30-Jun., 2022*	18-Jul., 2022	28-Oct., 2022 Symbolic Possession	UNIT-35, SHIVALIKA EXOTICA, S. NO. 802/3, VED TOWNSHIP ROAD, PADHMNABH CHOKDI, PATAN, MEHSANA-360530.
2	MR. BABUBHAI VIRABHAI CHAUDHARI (Borrower) MR. VIRABHAI PUNABHAI CHAUDHARI (Co-Borrower) Loan A/c No. 622143463 further interest as applicable, incidenta	As on 30-Jun., 2022*	18-Jul., 2022	28-Oct., 2022 Symbolic Possession	

However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above have failed to repay the amounts due, notice ereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and to the public in general that the Authorised Officer/s of HDFC have taken Possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of pow conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above. The borrower(s)/Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and the public in general are hereby cau eal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset

ubject to the Charge of Housing Development Finance Corporation Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect ne available to redeem the secured asset/s

Copies of the Panchanama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s)/ Legal Heir(s) / Legal entative(s) is/are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date: 31-10-2022 Place : Ahmedabad For, Housing Development Finance Corporation Ltd

Authorised Officer

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020 Corporate Identity Number: CIN: L70100MH1977PLC019916. E-mail: customer.service@hdfc.co

IDFC First Bank Limited

IDFC FIRST

CIN: L65110TN2014PLC097792 tered Office: - KRM Towers, 7th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel.: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

AUTHORIZED OFFICER – Himanshu Singh - Cont. No. 9621177755 | Debjyoti Roy - Cont. No. 9874702021

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)]
SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

F-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforce Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002 otice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the belo escribed immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which ha been taken by the Authorised Officer of erstwhile Capital First Home Finance Limited and Capital First Limited now IDFC FIRST Bank Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" On 18th Nov 2022 as described hereunder, for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to IDFC FIRST Bank Limited (erstwhile

Capital First Home Finance Limited and Capital First Limited). For detailed terms and conditions of the sale, please refer to the link provided in IDFC FIRST Bank website i.e. www.idfcfirstbank.com

S. No.	(I) Demand Notice Date and Amount	(ii) Name Borrower(s) and Co-Borrower(s)	(iii) Property Address	(iv) Reserve Price Amount	(v) EMD Amount	(vi) Date and Time of Auction	(vii) Date and Time of EMD Auction
1	INR 83,01,989.67/- Demand Notice Date: 13-Jun-2019	Sankari Arts And Jewellers, Sumita Supravat Daw, Supravat Laxminarayan Daw	The Property Bearing Nondh No. 1095/B/3 admeasuring 49.15.04 sq.mts, i.e. 58.78 Sq.Yard, Along with 180.93 Sq.Mts, Construction, in Situate at Ward No.10 of MojeAmliran Limdikui, City of Surat	INR 54,20,570/-	INR 5,42,057/-	18th Nov 2022 11.00 AM to 1.00 PM	17th Nov 2022 11.00 AM to 1.00 PM
2	INR 1,06,26,348.97/- Demand Notice Date: 14-May-2019	Vishaka Textiles, Ashwinkumar Hasmukhlal Marwala & Dharmistha Ashwinkumar Marwala	Property-1- Immovable Property, Premises of Ward No. 3, NONDH No. 1207 admeasuring 65.2181 sq. mtrs, having Construction on land admeasuring 190.12 sq. mtrs, Alongwith Proportaionate Undivided Share in Road, developed upon land situated in State: Gujarat, District: Surat, Sub- District & Taluka: Indarpura, Ranawad Ward Boundary of the property: East: Nondh No. 1206 Property, West: Nondh No. 1208 Property, North: Gali & South: Road	INR 78,35,940/-	INR 7,83,594/-	18th Nov 2022 11.00 AM to 1.00 PM	17th Nov 2022 11.00 AM to 1.00 PM
	INR 81,98,385.33/- Demand Notice Date: 14-May-2019		Proprety-2- Ward No. 3, Nondh No. 1726, A-2-3, Near Mahalaxmi Mandir, Sattar Kotadi, Salabatpura, Surat, Gujarat- 395002	INR 53,13,600/-	INR 5,31,360/-		

Disclaimer: Please note that the said notice is issued for sale of immovable property only and IDFC FIRST Bank Limited has no right to ale the movable assets, if any, present at the immovable property. Authorised Office IDFC FIRST Bank Limited (Formerly known as Capital First Home Finance Limited/ Capital First Limited

Chola

is" basis through E-Auction.

CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED

Corporate Office: No. 2, Dare House, 1st Floor, NSC Bose Road, Chennai-600001.

Branch Office: 407-408, 4th Floor, Yash Aqua Building, Above McDonald, Nr. Vijay Cross Road, Navi Ahmedabad-380009. Contact No:Nr. Nitin Panchal -8825438897

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES E-auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower / Co-Borrower / Mortgagor (s) that the below described immovable properties mortgagad to the Secured Creditor, the PHYSICAL POSSESSION of which has been taken by the Authorised Officer of Cholamandalam investment and Finance Company Limited the same shall be referred herein after as Cholamandalam investment and Finance Company Limited the same shall be referred herein after as Cholamandalam investment and Finance Company Limited the sold on "As is where is", "As is what is" and "Whatever there

icio noroby imorniou to conoral public the	to the cost in ordinary as in that we are going to conduct passion. Account an ordinary in the sale in ordinary as in ordinary						
A/C No. & Name of Borrower, Co-borrower, Mortgagors	Date & Amount as per Demand Notice u/s 13(2)	Descriptions of the property/Properties	Reserve Price, EMD & Bid Inc. Amount (In Rs.)	E-Auction Date and Time, EMD Submission Last Date, Inspection Date			
(Loan A/C No. X0HEAHM00001316649)		All that right, title & interest of the	Rs.40,00,000/-	17-11-2022 at 11:00			
Suresh Detaram Meghani, Pradeep	21-06-2021	property situated at RS No.	110.10,00,000	am to 1:00 PM (with			
Detaram Meghani, Balkishan Detaram	&	323/31, TPS No. 24, FP No. 250		unlimited extension			
Meghani & Yamuna Pradeep Meghani	Rs. 46,00,245.38/-	paiki, Eastern side property bearing land no.69 sq. yards, along with	Rs.4,00,000/-	of 5 min each).			
All Are Having Address For		construction being two shops at		01 0 111111 00011),			
Communication At 30/323 Sindhi	as on 21-06-2021	ground floor adm. about 26 sq.yards	Rs.50,000/-	11-11-2022			
Bungalow Nr Shanti Bag Daxini Soc. Maninagar, Ahmedabad – 380008 Also At, Parmanand Bungalows, Opp. M M		erty being Ground Floor and 1st floor (hokhara Mahemadabad, Taluka city, d		(up to 5.30.P.M)			
Khambhat Wala, Nr. Muni School, Daxini		ounded on the North by Sub-Plot No.	2, South by Sub	08-11-2022 (11.00			
Society, Maninagar, Ahmedabad-380008		P. Road, West by Adjacent property. parcel of property bearing House No.3	306 and 307 plot	A.M to 2.00. P.M)			

It is bereby informed to General public that we are going to conduct public F-Auction through website https://www.auctionfocus.in/chola-lar

area adm. about 207 sq. yards along with construction thereon including two shops at ground floor Narnarayan Society on land of FP No.250 paiki of TPS No.24 situate lying and being at mouje Khokhara Mahemadabad taluka city in the registration district of Ahmedabad and sub district of Ahmedabad-5 (Narol) the bounded On the North By Sub-Plot No.2 South By Plot No.4 East By T.P. Road West By Adjacent

24-06-2021
 & Property bearing Tenament No.7 (construction 150.50 sq. mtrs (built up area) in the society known as "Muril Manchar Co.Op. Hos.Soc. Ltd", situated on City Survey No. 3728, (New as on 23-06-2021 Survey No. 40/2/2, Old Survey No. 14/1, 4 14/2 paiki, mouje Saijpur Bogha, Rs.25,000/-(Loan A/C No. X0HEAHM00002551827) 17-11-2022 at 11:00 Karan Maheshkumar Ramchandani, Neha Harishkumar Budhraja &kanha unlimited extensio Fabrics All are having address for communication at 7, Murlimanohar Society, Bunglow Area, Kubernagar, Ahmedabad-382340 07-11-2022 (11.00 taluka Asarwa, dist. & sub district Ahmedabad – 6 (Naroda). Bounded By: **East**: 5 Mtr Road; **West**: Other Property; **North**: Bungalow No.6; **South**: 5 Mtr Road. A.M to 2.00. P.M)

1. All Interested participants / bidders are requested to visit the website https://www.auctionfocus.in/chola-lap & https://www.cholamandalam.com auction-notices. For details, help, procedure and online training on e-auction, prospective bidders may contact M/s. Auction Focus Private Limited Contact Prachi Trivedi Contact number: 9016641848. email id: support@auctionfocus.in

For further details on terms and conditions please visit https://www.auctionfocus.in/chola-lap & https://www.chola notices to take part in e-auction.

This is also a Statutory 15 Days Sale Notice Under Rule 8 & 9 of Security Interest (Enforcement) Rules, 2002 Sd/- Authorized Officer, Cholamandalam Investment and Finance Company Limited Date: 31.10.2022, Place: Ahmedabad

IDFC FIRST Bank Limited

(Formerly known as Capital First Home Finance Limited/ Capital First Limited) CIN: L65110TN2014PLC097792

Registered Office: - KRM Towers, 7th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

Authorized Officer – Himanshu Singh | Contact Number- 9621177755

Authorized Officer - Debiyoti Roy | Contact Number - 9874702021

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] **SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the below described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of erstwhile Capital First Home Finance Limited and Capital First Limited now IDFC FIRST Bank Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" On 18th Nov 2022 as described hereunder, for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Home Finance Limited and Capital First Limited).

S. NO	(i) Demand Notice Date and Amount	(ii) Name Borrower (s) and Co-Borrower (s)	(iii) PROPERTY ADDRESS	(iv) Reserve Price Amount	(v) EMD Amount	(vi) Date and Time of Auction	(vii) Date and Time of EMD Auction
1	INR	Jalpesh D Mahida	Immovable Property I.E Plot No.2	INR	INR	18th Nov	17th Nov
	8,46,267.8/-	& Ravindrasinh	(Panchayat Block No.433/11/K)	4,15,370/-	41,537/-	2022	2022
	30-May-2019	Mahida	Total Admeasuring 67 Sq.Mtrs Area			11.00 AM to	
			And 39.515 Sq.Mtrs Constructed			1.00 PM	
			Area, Situated In Land Bearing R.S				
			No.1442/1 Of The Sim Of Village				
			Adas, Dist And Sub Dist And Sub Dist				
			Anand Said Property Is Bounded-				
			East: 20 Fit Road, West: After				
			Leaving 3 Mtrs Open Land R.S				
			No.1445, North: Plot No 3 & South:				
			Plot No.1				

For detailed terms and conditions of the sale, please refer to the link provided in IDFC FIRST Bank website i.e. www.idfcfirstbank.com

Authorized Officer IDFC FIRST Bank Limited (Formerly known as Capital First Home Finance Limited/ Capital First Limited)

IDFC FIRST

Bank

Date: 31.10.2022



State Bank of India RASMECCC-SARC, 3rd FLOOR, MERRY GOLD,

OPP. BAHUDIN COLLEGE, JUNAGADH -362001. Tel: 0285 - 2655245, E.mail: sbi.13206@sbi.co.in

DEMAND NOTICE under Section 13(2) of Securitisation Act of 2002 As the Loan Account Became NPA therefore The Authorised Officer (AO) under section 13(2) of Securitisation and

Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act 2002 had issued 60 day demand notice to the borrower as given in the table. According to the Notice if the Borrower does not deposit the Amount within 60 days. the amount will be recovered from Auction of the security as given below. As the demand Notice send to the wer/guarantor has not been served, copy of demand notice has also been affixed on the secured assets as given below. Therefore, you the borrower is informed to deposit the loan amount along with future interest and recovery expenses within 60 days, otherwise under the provisions of section 13(4) and 14 of the said Act, the AO is free to take possession of the Security as given below.

Sr. No.	Name of the Borrower	Date & Amount of Demand Notice under Sec. 13(2)	Description of the Property
1.	Mrs. Ramaben Jitendrabhai Nathvani Mr. Jitendrabhai LiladharbhaiNathvani Loan Account No. 38335795846 38338658502 38335836250	16.09.2022 Rs. 5,54,643/- as on 16.09.2022	All that piece and parcel of Residential house situated at Flat No 104, admeasured at 37.18 sq mtrs on First Floor in "Savaram Complex" constructed on land of Plot No. 1 pike (1-A), admeasured at 260.665 sq mtrs, which is a part of nonagriculture land bearing R.S. No 82 pike acre 3.35 gunthas, situated at village Timbavadi, within limits of Municipal Corporation Junagadh. which is bounded as under. East: - Main Door of Flat, common passage and stair passage West: - Property on Plot no 2 North: - Adj Flat no 103, common wall South: -Road then others property.

Date: 31.10.2022 **Authorised Officer** Place: Junagadh State Bank of India

IDFC First Bank Limited

(erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) CIN: L65110TN2014PLC097792

Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

> Notice under Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers nave been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice	Property Address
1	10047046027	Bharat	1. Delson India Foods	19.10.2022	INR	All That Piece And Parcel Of Leasehold
	&	Banking	2. Mahesh K		2,00,68,971.00/-	Industrial Shed No.617 (c1-617) Admeasuring
	10057720291	OD -	Delvadiya			703.95 Sq. Mtrs., Alongwith Construction
		Secured &	3. Manisha M			Thereon, In Wadhwan Industrial Estate
		Eclgs	Delvadiya			Situated On The Land Of Revenue Survey
		WCTL	4. Naran Patel			No.1865/1 Part Situate, Lying And Being At
			Komal N Patel			Mouje: Wadhwan, Taluka: Wadhwan, In The
			6. Harikrushna			Registration District Of Surendranagar And
			Processing			Sub District Of Wadhwan, Gujarat And
			Pvt. Ltd.			Bounded As: East: 14-00 Mtr. Gidc Road,
						West : Shed No. C1-614, North: Shed No.
						C1-618, South: Shed No. C1-616

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective lates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to nitiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned nereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by vay of sale/lease or otherwise.

Authorized Officer IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited)

Date: 01.11.2022

Place : Gujarat

NOTICE

દુષ્કર્મના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ

દુષ્કર્મના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનો टेस्ट કરશે तो ते व्यक्तिने ગેરવર્તાશૂકનો દોષી ઠેરવવામાં **પણ ટુ ફિંગર ટેસ્ટ ચાલી** આવશે. રેપ-હત્યાના મામલે નિર્ણય સંભળાવતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે પીડિતાના યૌન ટેસ્ટને હટાવી દેવાનો આદેશ ઈતિહાસ પુરાવા મામલે કોઈ આપતા કહ્યુ કે બળાત્કાર ૨૦૧૩માં આ પ્રથાને સામગ્રી નથી. જસ્ટિસે કહ્યુ કે એ પીડિતાની તપાસ કરવાની આ ગેરબંધારણીય માની હતી અને ખેદજનક છે કે આજે પણ ટ્ર અવૈજ્ઞાનિક આક્રમક રીત યૌન કહ્યુ હતુ કે આ રીતનો ટેસ્ટ કરવો ફિંગર ટેસ્ટ ચાલી રહ્યો હતો.

કોર્ટે મેડીકલ કોલેજોના ફરીથી દુઃખી કરે છે અને સાથે

પીડિતાના યૌન ઈતિહાસ પુરાવા મામલે કોઈ સામગ્રી નથી, એ ખેદજનક છે કે આજે રહ્યો હતો

શો પણની પીડિત મહિલાને જોઈએ નહીં.

કોરોનાના કેસમાં ઘટાડાની વચ્ચે ચિંતાના સામાચાર

ઓમિક્રોનના સબ વેરીએન્ટ

એક્સબીબીના ૯ રાજ્યોમાં કેસ

સૂપ્રીમ કોર્ટે સોમવારે અભ્યાસક્રમોમાંથી ટુ ફિંગર જ તેમની સાથે ઘટેલી ઘટનાની ફરીથી યાદ અપાવે છે.

> સુનાવણી દરમિયાન રેપ-હત્યાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આરોપીની મુક્તિના આદેશને પલટી દીધો, સાથે જ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી. જેની પર સુનાવણી ચાલી રહી હતી.

> ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે



ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૩૮મી પૂણ્યતિથિ નિમિત્તે પાટનગર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શ્રીમતી સોનિયા ગાંધી શ્રધ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને સરકાર સામે બાંયો ચઢાવી

મહિલા પત્રકાર કચડાતા ઈમરાન ખાને લોંગ માર્ચ અટકાવી દીધી

પાકિસ્તાનની ચેનલપ માટે વળ્યું હતું.

કાર્ય કરી રહેલી સદાફ નઈમ

ઇસ્લામાબાદ, તા.૩૧ ઇમરાન ખાને આ રેલી રાજધાની પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇસ્લાબાદ ખાતે શરુ કરી છે. ઇમરાન ખાને વર્તમાન સરકાર કરાંચી ખાતેથી આ ઘટના અંગે સામે શરુ કરેલી 'લોંગ માર્ચ' એક બોલતા લુબના જેરાર નકવીએ દિવસ માટે અટકાવી દેવાની ફરજ જણાવ્યું હતું કે આ કમનસીબ આ માર્ચમાં ઇમરાન ખાન જે ઉપરથી ઇમરાન ખાનની રેલીનું ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ આતંકવાદી સંગઠન માટે કામ કરી વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા કવરેજ કરી રહી હતી તેના તેની નીચે એક મહિલા પત્રકાર ઉપરથી જ તેમનો પગ લપસતા અકસ્માતે કચડાય જતા આ માર્ચ તે રોડ ઉપર પટકાયા હતા અને એક દિવસ અટકાવી દેવી પડી છે. એ કન્ટેનરનું પૈડું તેમના ઉપર ફરી

આ ઘટનાના પગલે ઇમરાન ઇમરાન ખાન જે વાહનમાં પ્રવાસ ખાંતે એક દિવસ માર્ચ બંધ કરી રહ્યા હતા એ કન્ટેનર ઉપરથી રાખવાની જાહેરાત કરી હતી. પગ લપસી જતા રોડ ઉપર ઇમરાન ખાને મૃત પત્રકારના પટકાયા હતા અને આ કન્ટેનર પરિવારને શોક સંદેશમાં અજાણ્વ્યું તેમના ઉપર ફરી વળ્યું હોવાથી હતું કે આ ઘટના અંગે મારી પાસે નઈમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું કોઈ શબ્દો નથી પણ મૃતક હતું. ઓક્ટોબરની તા. ૨૯થી પત્રકારના માનમાં હું એક દિવસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન મારી માર્ચ અટકાવી રહ્યો છું.

૮૦૦ વર્ષથી નિષ્ક્રિય રહેલો જવાળામુખી ફરી હલચલ

જુનઉતા.૩૧ હાથ ધર્યું છે. માઉન્ટ એજકમ્બે એક વિશાળ જવાળામુખી જેને ૮૦૦ વર્ષ સુધી કો ઈપણ ૮૦૦ વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય ધરતીકંપની પ્રવૃત્તિ વિના નિષ્ક્રિય જાહેર કરવામાં આવ્યો હતો, ત્યાં જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, ફરી એકવાર હલચલ મચી ગઈ છે. આ નવું સંશોધન સૂચવે છે કે વધુ ચેતવણી જાહેર કરી છે. ખરેખર, શક્ચ બની શકે છે. ઓક્સફર્ડ અમેરિકાના અલાસ્કામાં માઉન્ટ યુનિવર્સિટીના જ્વાળામુખી એજકમ્બેમાં તાજેતરમાં એક પછી વિજ્ઞાની ડેવિડ પાયલે ન્યૂઝવીકને એક ભૂકંપના અનેક આંચકા જણાવ્યું હતું કે, 'જયારે મેગ્મા અનુભવાયા હતા. આવી સ્થિતિમાં, ગતિશીલ હોય છે, ત્યારે તે કાં તો વૈજ્ઞાનિકોને લાગે છે કે આ વિશાળ તિરાડો સાથે તેનો માર્ગ બનાવી શકે ઓ બ્ઝર્વેટરીએ તાજેતરની ધરતીકંપો છે. સિસ્મોમીટર ખૂબ જ અ ૯ટ્ ા ટે ક ગતિવિધિઓને શોધવા માટે નાના આંચકા અને ધરતીકંપને સેટેલાઇટ ઈમેજરી અને ગાણિતિક શોધી શકે છે. જેમ જેમ મેગ્મા મોડેલિંગનો ઉપયોગ કરીને સંશોધન સપાટી તરફ ઉપર તરફ ધકેલે છે.

ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ. હરાજી નોટિસ

આથી, જાહેર જનતાને જજ્ઞાવવામાં આવે છે કે કેડબેંક કાઇનાન્સિયલ સર્વિસિઝ લિ.એ મુદતવીતી અથવા કસૂર કરેલ અથવા માર્જિ મંગ કરનારા સંબંધિત ગ્રાહકોના ખાતાંઓના (નીચે આપેલ વિગતે) સોનાનાં ઘરેણાંની હરાજી કરવાનું નક્કી કર્યું છે. હરાજી નીચે આપેલ કંબંધિત શાખાઓમાં શુક્રવાર તા.૧૧-૧૧-૨૦૨૨ના રોજ સવારે ૧૦,૦૦ થી. બમોરે ૧૨.૦૦ - વચ્ચે રાખવામાં આવશે જે હરાજીન પ્રક્રિયા પતે ત્યાં સુધી ચાલુ રહેશે.

અમસોલી ୦૨૧૧-૨૪૯૫૦૦૫ FEDGL૦૧૩૯૦૦૦૨૪૩૪, ୦୦୦૨૪૭૧, ୦୦୦૨૪૭૭, ୦୦୦૨૭୦୦, ୦୦୦૨૭୦૩ ଲାଉ ୯୯୧૫୫୫୫୧୯୫ FEDGL୦୪୯୩୦୦୦୦୦୧୧ ଐଷ୍ଟ ୧୧୯୫୫-୧୪୯୩୦୦ FEDGL୦୫୪୯୦୦୦୩୯୧୩, ୦୦୦୩୯୯୧ actesy, adotest, dootety, oootete, dootets, ooosyos, ooosyos, adosyte, daayst occygga આશ્રમરોડ લ્પવરલલપ્રલલ FEDGLo338000વલ્લક, occagga, occagge, occagga માલાસિનો ୧୦୧୯/୧୦୭୦୧୫/ FEDGL03460000941, ୨୦୦୦୫୧୨, ୨୦୦୦୫୧୪, ୦୦୦୦୫୧୪, ୦୦୦୦୧୯୫, ୦୦୦୦୧୯୫, ୧୦୦୦୧୧୧ ୩୩୯-୧୩୧ ୨୦୫୯-୧୧୫୦୧୧୪୩ FEDGL00680001668 , ୦୦୦୩୧୫६, ୦୦୦୩୧୫୧, ୦୦୦୩୧୦୨, ୦୦୦୧୧୯୫, ୦୦୦୧୧୯୫, ୨୦୦୧୧୯୧୯, ୦୦୦୧୧୩୬୩(୧୩ ୫୨୫୧୯୪୧୧୧ FEDGL018)୧୦୦୩୧୪୧, ୦୦୦୩୧୪୧, ୦୦୦୩୧୫୧, ୦୦୦୩୧୫୧୩(୧୩ окочи-квоиха FEDGLочвоосоквоч , осокачк, осокача, осоквию, осоквии, осокажч ૦૦૦૨૩૭૬, ૦૦૦૨૩૭૭, ૦૦૦૨૩૮૧, ૦૦૦૨૩૮૨, ૦૦૦૨૩૮૮, ૦૦૦૩૬૦૪ ભગવતી માણસા ૦૨૭૬૩-૨૭૩૨૦ FEDGL03૪૦૦૦૦૧૧૬૯ , ૦૦૦૧૧૭૩, ૦૦૦૧૨૦૯, ૦૦૦૨૦૩૨ ભાવનગર વાધાવાડી રોડ ૦૨૭૮૨૫૬૦ FEDGLONSZOCOCNSE PĺZIE ORZNE-RHRINN FEDGLONHSCOCSKRIS, CCCSKRZ, CCCSKZN, CCCSK оравля, сроваях, осраваю, сорвахо, ороваха, ороваха, оровачо, оорхавх ф 2193180315 FEDGL03710050878 , 5051503, 0501012, 0001523, 0001037, 050128 ୧୯୭୬/୩୫୧୫/୩୭ FEDGL03/୩୦୦୦୦୧୫ , ୦୦୦୯୦୭, ୦୦୦୯୦୮, ୦୦୦୯୬୫, ୦୦୦୯୬୫, ୦୦୦୯୬୫, ୦୦୦୯୬୫, ୦୦୦୯୬୫, ୨୦୦୩୫୧ ସିଧିୟେଥ୍ୟ ଅଟେଥିଲେ FEDGL03% ୧୦୦୦୧୫, ୦୦୦୦୧୬, ୦୦୦୯୬୫, ୦୦୦୧୬୪, ୦୦୦୯୬୬୭, ୨୦୦୩୫୧୪ ସିଆଖ ୧୭୭୪/୩୫/୩୪/୩୪ FEDGL01% ୧୦୦୦୧୫, ୦୦୦୯୫୯, ୦୦୦୯୬୧, ୦୦୦୯୫୯, ୬୦୦୦୩୫୯, ୬୦୦୯୩୫, ୬୦୦୯୩୫, ୬୦୦୯୩୫୯ oportri ilizalizat ode-tekoster FEDADOSAKOSTTSK IIIS SIZEK-EXAKK FEDADOSAKOGORIK, GOOGKOK, GOOGKS, COOKSIS, COOKSIS KIHAHUS CSAS ZAZNIKO FEDADOSAKODOOKKI, OCOOKSO, SOOKSIS, SOOKSIS, COOKSIS, COOTES KIHAHUS CSAS SYYKERCECY FEDGLONINGODROKY, CODROKE, COCROSE, COCRICE, COCRISE, COCRISE DORNYN, CCCREZN, 6663082, 66634NO YHINE CRZNREGESS, ZROONNEENN FEDGLOSKICCCONKOS ೨೦೦೮, 10 ರ. 38 ರ. ನೀರ್ನೆ ನೀರುವ FEDGLO 1330001347, 0001413, 0003462 ಕಡೆಟ ರ. ೨೫೫-೩೩೩೩೦ FEDGLO 1360001386, 0003386, 0003869, 0003914, 0003816, 000383, 1488 ರ. ೭೪೩೩೮೩೦ FEDGLO 146003806, 0003386, 000388, 0003890, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386, 000386 ૦૦૦૨૭૫૭ ખોડિયાર કોલોની જામનગર ૯૫૭૪૪૪૦૯૪૪ FEDGL0૪૫૬૦૦૦૦૦૦૮ , ૦૦૦૦૫૫૧ કોઠારિયા રોડ erisessisest FEDGLasecoactivr igitalitase-tizallita FEDGLalviaaaaas FEDGLalviaaatetu, aasteue, aastesl, aastell, aastell, aastellaatellii telus-teltaa teato FEDGLassicoatell, aastella aastellaatellii aastella aastellaatella odraku, oddrake, oddrake, oddrasa, oddrasa, oddrasy, oddreka misil kauaueruci FEDGLa3veaccas33, acca33e, caca33e, coortee 40H4Rase-t 4ve334e FEDGLacetacotet सामग्री मेथीन हो। १५५३७७३५७४१ FEDGLO1४८०००६५६७ , ०००६५७५, ०००६६०६, ०००६६२६, ०००८५७५ ०००५७४८ मोनेग्रामा ४४६१८७६३०८ FEDGL03५७००००१४५ , ००००५७५, ०००६६७७ मेथी ०७४-१२६०५३५ FEDGL00७९००५५०, ०००९७५३, ०००२४४७, ०००५४५० मोग्रामा ०६७७४२४४६४४ (FEDGL05५७०००००१ ૦૧૧૦૬, ૦૦૦૧૧૧૭, ૦૦૦૧૩૧૧, ૦૦૦૧૩૪૯, ૦૦૦૧૩૫૦, ૦૦૦૧૨૫૮ મોરબી ૦૨૮૨-૨૨૨૨૬૨ FEDGL038२000२४८४, ೧६०२५७८, ೧००२५५६, ೧००२५४४, ೧८०२५४५, ೧६०२५७२, ೧६०३६४४, ೧६०३७४७ ೧६०३७७४, ೧६०३७७५, ೧००४४४४, ೧६०४४७०, ೧००४४५४ भोडी रोडी ७७७८४४५५५ FEDGL0440०००२०७८ 2005063, 300210 fja: 24033330 FEDGLOXY40000000, 000041, 000060 (lydis 0210 {{Vyaoy FEDGL0386001643, 0001630, 0001684, 0001687, 0001681, 0001684, 0001684 aattii, aaatiitii, aaatiitii, aaatiitii, aaatiitii, aaattii, aaattii, aaattii, aaattii, aaattii, aaattii DODRKKO, ODDRKBY ÝLYÍSZ RKARRYDYGO FEDGLOBRODGOMYYM, ODDMYKM, ODDMYKR, ODDMYKR ०००२५७म, ०००२५७८, ०००१५७८, ०००१५१०, ०००१५११, ०००१५१२, ०००२५८२, ०००२५८२, ०००२५८२ सामगुर कणार्वणभञ्जट FEDGL0३४७०००१५७५, ०००१४८१, ०००१५४६, ०००२८४१ रीस से, १८०५४०६७ FEDGL0४४८०००४०म सुर्व सामसासि से, १८०४०६४५४४४ FEDGL0४४८०००३१२, ००००१३२, ००००१४ ०००७१८५, ०००७१८१ सामोह ४७३५४७५५० FEDGL0४४८०००२१५, ००००१३२, ००००॥३८ सामास 23/Y00020# FEDGL03040000000, FEDGL03040003#03, COCR#R#, COCGRGR, COCGRAR, ೨೯೨೪೪ (ಕ್ಷಿಟ್ನೆ ರನಿಜಿಇ- ನಿಕಿತಿಅಳ FEDGLಯಕ್ಕೆಕೆಯಿಂದಲ್ಲೇ, ಎಂದುವರಲ ಕ್ಷೇನ್ಗಳುಕಿ ಇನಡು ರನಿಜಿಳ-ನಿಕಿಗಿತ EDGLವತಿತೆಗೆಯರನ್ನೇಗೆ , ಎಂದನ್ನನ್ನು ಎಂದನ್ನನ್ನು ಎಂದನೀಂತ್ರ ಎಂದನೀಂತ್ರ ಎಂದನೀಂಗು, ಎಂದನೀಂಗೆ ತಿರುವನೀಕ ೨೦೨೯೫೪ ೨೦೦೪ನಕ್ಕೂ,೦೦೦ಳಗಳೂ,೦೦೦ಳಗಳನ್ನ, ೧೦೦೪ನನ್ನ ಎಂದಳನನ್ನ, ೦೦೦ಳನನ್ನ, ೦೦೦ಳನ್ನೂ, ೦೦೦ಳನೇಂತ್ರ ಡೆಸಿಸು ರನಿನಗೆ ??8800N FEDGLONY20003NY#, 0003N8Y, 0003N9N, 0003N2#, 00036N#, 00036N#, 0003KN 003691, 0008486, 0008486, 0008448, 0008461, 0004180 988U 666980619 FEDGLOYNYCODDSER, CODYRTH, CODTREY HILL DIRECTSYSSS FEDGLOYRECODDSER, CODCODE CODCOCK, COCCEE, COCCECS, COCCECH, COCHYSK, COCHYSK, COCCESS, COCHYRH, COCHYRH COCCYSC HNIB CREETKER FEDGLORECOCHER, COCHRE, COCHRES, COCHRES, COCHRES, COCHRES posteet, acatees, scattist, acottot, coottit film tidettteet FEDGLaseeaantist 338,5002,587,000,388,000,388,0001,386,0001,384,0001,386,0001,388

સ્થળ કે તારીખમાં ફેરફાર હશે. તો અમારી વેબસાઇટ www.fedfina.com પર દર્શાવવામાં આવશે.ભાગ લેનાર તમામ ભીડરો નીડના સ્વીકાર અથવા નકાર બાબતે તેમણે બીડ જમા કર્યા બાદ જાણ કરવામાં આવશે.. જે સાહક પોતાના દાગીના છોડાવવા માંગતા હો ાં જે શાખામાં દાગીના પ્લેજ પ્રયો હોય તે માખાનો ૧૦-૧૧ -૨૦૬૨ પહેલા અથવા ત્યાં કુમારન પાત્ર તામાં અન્યા છોકાવના મામે છે. જે જાણામાં દાગીના પ્લેજ પ્રયો હોય તે માખાનો ૧૦-૧૧ -૨૦૬૨ પહેલા અથવા ત્યાં કુમીમાં ઉપર આપેલ નેગર પર સપ્કે કરી જો જે જાણુ પડતા નિયમો અને શસ્તોને આપીન સ્હેશો. હદાજી સંબંધિત શાખાઓમાં થશે, જો હદાજી આપેલ તારીખે કોઈ પણ કારળકાદ થા ાર્દ[પુરી ન શાય તો એ રોબંધિત હરાજી અમારી વેબસાઇટ પર વિગતો દર્શાવ્યા ભાદ, પછીના કામકાજી દિવસે યોજવામાં આવશે સંબંધ વધુ કોઈ વાતચીત થઈ શકશે નહીં.

તારીખઃ૦૧-૧૧-૨૦૨૨

વતી, સહી! અધિકૃત હસ્તાક્ષરકત

જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં સેનાનું ઓપરેશન

કાશ્મીરમાં આતંકવાદી ઠાર, આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ

પાકિસ્તાની આતંકવાદીઓની તપાસ દરમિયાન ડોડાના ચંદર કન્સાઈનમેન્ટ ઓપરેટર્સ બંને ઘુસણખોરીના મોટા કાવતરાને બોઝ અને કેમ્પ ગોલ ગુજરાલ, સાથે સંકલન કરતો હતો. નિષ્ફળ બનાવ્યં છે. આ જમ્મનાશમશેરસિંહને પકડવામાં

ઓપરેશનમાં એક પાકિસ્તાની આવ્યા હતા. અધિકારીઓએ આતંકવાદી માર્યો ગયો છે. સેના જણાવ્યું કે તેમની પાસેથી ચાર દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. આ પિસ્તોલ, આઠ મેગેઝીન અને ૪૭ અગાઉ સોમવારે સવારે સુરક્ષા ગોળીઓ મળી આવી છે. દળોએ શોપિયાં જિલ્લાના બાલાપોરામાંથી

આતંકવાદીઓની ધરપકડ કરી કર્યો કે, તે સિંઘના ઈશારે કામ કરી હતી. બંને પાસેથી હથિયાર અને રહ્યો હતો. અધિકારીઓએ દારૂગોળો મળી આવ્યો હતો.

મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હોવાનો યુરોપમાં છે. સિંઘે કહ્યું કે અમે બંને દાવો કર્યો હતો જેને યુરોપથી બલવિંદર નામના ઓવરગ્રાઉન્ડ સંચાલિત કરવામાં આવી રહ્યું વર્કર (ઓજીડબલ્યું)ના સંપર્કમાં હતું. પોલીસે જમ્મુમાં પાકિસ્તાન હતા જેઓ જમ્મુના છે અને હવે તરફથી ડ્રોનની મદદથી હથિયારો યુરોપમાં સ્થાયી થયા છે. અને વિસ્ફોટકોનો જથ્થો ઉતારવામાં સામેલ બે લોકોની કરાયેલા આરોપીઓ અને ઘટનામાં નઈમ જે કન્ટેનર ધરપકડ કરી હતી. આરએસ પુરા ઓડીડબલ્યું

સેનાએ જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાં ડ્રોન દ્વારા હથિયાર ભારતમાં આરોપીઓ અને

એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે,

બે પૂછપરછ દરમિયાન બોસે ખુલાસો જણાવ્યું કે બંનેની પૂછપરછ બીજી તરફ જમ્મુ-કાશ્મીર દરમિયાન જાણવા મળ્યું કે, પોલીસે રવિવારે એક આતંકવાદી આતંકવાદી મોડ્યુલનો ઓપરેટર

> તેમણે કહ્યું કે, ધરપકડ પ્રતિબંધિત

શ્રીનગર, તા.૩૧ (આઈબી) સાથે બાસપુર બાંગ્લા રહ્યા છે. તેમણે કહ્યું કે, બલવિંદર કુપવાડાજિલ્લાના કેરન સેક્ટરમાં ઉતારવામાં આવ્યા હોવાની પાકિસ્તાનમાં હથિયારોના

મોરબી દુર્ઘટના સંદર્ભ તા.૨જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક

ગાંધીનગર,તા.૩૧ મોરબીની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટ્વિટ કરીને આગામી તા.૨ નવેમ્બરે રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય ઉચ્ચસ્તરીય બેઠકમાં લીધો હતો.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. તા.ર નવેમ્બરે રાજ્યની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઇ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

અલ્ટ્રાટેક

એશિયન પેઇન્ટ સેન્સેક્સ

સેન્સેક્સમાં ૭૮૬, નિફ્ટીમાં ૨૨૫ પોઈન્ટનો ઊછાળો

ઓટો, આઇટી શેરોના નેફ્ટી-સેન્સેક્સ મહિનાની ટોચે

મુંબઈ, તા.૩૧ રાખવામાં સફળ રહ્યો હતો, હોસ્પિટલ, ડૉ. રેક્રી લેબ્સ, ભારતીય શેરબજારમાં જેના કારણે નિફ્ટી અને એનટીપીસી, ઇન્ડસઇન્ડ, રોકાણકારો માટે સોમવારનો સેન્સેક્સ એક મહિનાની ટોચ બ્રિટાનિયા અને ટાટા સ્ટીલ દિવસ લાભદાયી રહ્યો. પરબંધથયા હતા. નિફ્ટીના નીચા મથાળે બંધથયા છે. બીએસઈ સેન્સેક્સ અને તમામ ઈન્ડેક્સ લીલા એનએસઈ નિફ્ટી ઉછાળા નિશાનમાં બંધ થયા છે. એમએન્ડએમ, એલએન્ડટી, સાથે બંધ થયા છે. બીએસઈ ઓટો, આઈટી, ફિન સર્વિસ, એચડીએફસી, સન ફાર્મા, સેન્સેક્સ ૭૮૬ પોઈન્ટ અથવા ફાર્મા અને એનર્જી ઈન્ડેક્સમાં એચડીએફસી બેક્ર, બજાજ ૧.૩૧ ટકા વધીને ૬૦,૭૪૬ સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, પર અને એનએસઈ નિફ્ટી હતો. નિફ્ટી પેકમાં અલ્ટ્રાટેક પેકમાં ટોપ ગેઇનર હતા. ૨૨૫ પોઈન્ટ અથવા ૧.૨૭ ટકા વધીને ૧૮,૦૧૨ પર બંધ સિમેન્ટ ટોપ ગેઇનર હતો. માત્ર ડૉ. રેક્રી લેબ્સ, ટાટા થયો હતો. શેરબજારમાં તેના લીધે એચડીએફસી, સ્ટીલ, ઈન્ડસઈન્ડ અને

તેથી, વૈજ્ઞાનિકોએ આ અંગે જ્વાળામુખીની પ્રવૃત્તિ ટૂંકસમયમાં ચોતરફ ખરીદી જોવા મળી એમએન્ડએમ, આઈશર એનટીપીસી ખોટ સાથે બંધ હતી. આ કારણે મુખ્ય મોટર્સ, સન ફાર્મા અને થયા.સોમવારે ભારતીય સ્ચકાં કો નિફ્ટી અને એફડીએફસી બેંક લાભ સાથે રૂપિયો ડોલર સામે ૩૧ પૈસા સેન્સેક્સની સાથે બજારના બંધથવામાં કામ કરી રહી છે. ઘટીને ૮૨.૭૮ ના સ્તર પર તમામ સૂચકાંકો લીલા બીજી તરફ અપોલો બંધથયો હતો. નિશાનમાં

જવાળામુખી ફરીથી જાગી શકે છે. છે અથવા ઊંડાણમાં ઓગળતા બંધ થવામાં એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિ. બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર વિસ્તરતા પૂલની રચના કરી શકે છે સફળ થયા કરી શકે છે સફળ થયા અનુસાર, અલાસ્કા વોલ્કેનો અને આ બંને પશ્ચિયાઓ નાના જે આવેલા છે. પ્રત્યા મુંબઈ-૪૦૦૦ ૭૦ ૫૨,૫૦૦ માઈલ પ્રતિ અનુસાર, અલાસ્કા વોલ્કેનો અને આ બંને પ્રક્રિયાઓ નાના છે. આજે જિલ્લ ઑક્સનું સરનાધું ઓક્સિ ૩૦૧,૩૦૨,૩૦૨,૩૦૨,૩૦૨,૩૦૩,૩૦૪, જે મળે, આઇલિઝન, ક્ષાવાલિક પ્લાઝા સામે, પાઇપાયાએ, પાઇપાયાને, પાઇપાયાએ, પાઇપાયાને, પ

સરફેસી કાયદો, ૨૦૦૨ ના સેક્શન ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે દેશદાર રોએ ઈએચએકએલ પાસેથી મેળવેલ લોન સુવિધાઓ ગેઇનર હતો. આાજ

શેરબજારની શરૂઆાત મોટા ઉછાળા સાથે થઈ હતી અને દિવસના કારો બાર સીમાઓ: ઉત્તરે: ખુલ્લી જગ્યા , દક્ષિણે: ક્લેટ નં. H ર૦૨, પૂર્વે: ગ્લોકોં, પશ્ચિમ: ક્લેટ નં. H ર૦૪. દરમિયાન બજાર આ

લાભને

સિમેન્ટ ટોપ કરા રેલ છે અને તર લોન ખાતા નોનપકાર્યો એક કેટ્રાઇટાઇટ અભ્યાનમાં મહત્વ હતા મુખ્યાના લુખ નવા ના ના મહત્વ હતા. લી સિમ્પોરિટાઇડોશન એના દિકન્દ્રકાના ઓક કાયના સ્થિત એન્ટ્રેસ (નેનપીએ) તરીકે વર્ગીકૃત થયેલ છે. લી સિમ્પોરિટાઇડોશન એના દિકન્દ્રકાના ઓક કાયના સ્થિત એન્ટ્રેસ એન્ડ એન્કોર્સનેન્ટ ઓક સિમ્પોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (સરફેસી

કાયદો)ના સેક્શન ૧૩(૨) હેઠળ તેમને છેલ્લા જાણીતા સરનામે ડિમાન્ડ નોટિંસ મોકલવામાં આવી હતી. સદર ડિમાન્ડ નોટિંસ ઉપરાંત, તેમને આ જાહેર તેટિંસ દ્વારા જાણ કરવામાં આવે છે. દેશદારો, સિક્યોરિટીઝ, બાકી લેશી ૨કમ, સેક્શન ૧૩(૨) હેઠળ મોકલેલ ઉમાન્ડ નોટિસ અને એમાં દાવો કરેલ ૨કમ વગેરેની વિગતો નીચે

૧. કેળકાર, અન્કેલકાર, બમીવકારનો નામ-સરનામું અને લોનની રક્યઃ ામસિંઘ માલારામ જોગીડ દિરાદાર) અને પૂજા રામસિંઘ (સહ-દેવાદાર), બંને રહે. : જ~૫, મહાલીર કોમ્પ્યેક્સ મૃંપ, હરિયામ હરિયેલા પાર્ચાનાથ ટાઉનશી કૃષ્યનગર, સૈજપુર બોધા, અમદાવાદ-૩૮૨૩૪૫ તોન ખાતા નંબર: LAHMSTH0000030458 લોન એગ્રીમેન્ટતારીખ: ૨૮,૦૯,૨૦૧૦ ડેમાન્ડ નોટિસ તારીખ: ૦૯-સપ્ટે-૨૨

લોત્તની રકમઃ રૂ. ૧૪,૫૦,૦૦૦/-(એક રૂપિયા ચોંદલાખ પચાસ હજાર પૂરા કક્ત) લેલી નીકળતી રકમ ઃ રૂ. ૧૧,૮૩,૧૩૬.૮૪/- (એક અગિયાર લાખ વ્યાસ હજાર એકસો છબીસ અને પૈસા ચોર્યાસી પૂરા) સિક્યોર્ડ અસ્ક્યાયતની વિગતો : મોજે: મુક્રિયા, તાલુકો: અસારવા, જિલ્લો અને પેટા જિલ્લો અમદાવાદ ખાતે શ્લોક નં. ૯૯, દીપીએસ નં. ૭૫, એક પી નં. ૭૮ એસપી નં.૨ પારક 'વાઇઅન્ટ હોમ્સ'ના બ્લોક H, ૨જે માગે ક્લેટ નં. ૨૦૧ પારક (માપણી લગભગ ૮૪.૪૦ ચો.મી.)ના તમાય હક્કહિસ્સા. સદર ક્લેટન

તમે ઉપરના દેવાદાર/રોને આથી ઉપર જવાવેલ બાદી નીકળતી લેશી રક્ય આ નોટિસના દિન ૧૦માં ભરપાઈ કરી જવા જવાવવામાં આવે છે, એમાં કસુર થયેથી નીચે સહી કરનારને નાક્ટુટકે સરકેસી કાયદા હેઠળ ઉપર જણાવેલ સિક્યોરિટીઝ જપ્ત કરવાની કરજ પડશે. મહેરભાની કરીને નોંય લેવી કે સદર કાયદાના સેઠશન ૧૭(૧૭) મુજબ, આપને ઉપર જણાવેલ સિક્યોરિટીઝ અમારી પંજુરી વગર વેચાલ, લિઝ કે અન્ય કોઈ રીતે તબદિલ કરવા સામે યનાઇ કરમાવવામાં આવે છે.

જા ળ વ ી સ્થળઃ અમદાવાદ તારીખઃ ૨૬.૦૭.૨૦૨૨

પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ–વડનગર ની વચ્ચે નવી ઇન્ટરસિટી એક્સપ્રેસ (૦૨/૧૧/૨૦૨૨ થી)

ट्रेन नं.	પ્રારંભિક સ્ટેશન અને ગંતવ્ય	પ્રસ્થાન	આગમ ન
16006	વલસાડ – વડનગર	૦૫.૪૫ વાગે (દૈનિક)	૧૨.૪૫ વાગે (તે જ દિવસે)
16010	વડનગર – વલસાડ	૧૬.૪૫ વાગે (દૈનિક)	00.3૫ વાગે (બીજા દિવસે)

થોભોઃ નવસારી, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, નડિચાદ, અમદાવાદ, ગાંધી નગર કેપિટલ અને મહેસાણા સ્ટેશન્સ બન્ને દિશામાં.

સંરચનાઃ વાતાનુકૃતિત ચેર કાર, ચેર કાર અને સામાન્ય દ્વિતીય શ્રેણી ડબ્બો.

પ્રારંભિક વિશેષ ટ્રેન નં. ૦૯૦૧૫ સુપરફાસ્ટ સ્પેશલ વલસાડથી ૦૨/૧૧/૨૦૨૨ના રોજ ૦૯.૧૫ કલાકે ઉપડશે અને ૧૬.૪૫ કલાકે વડનગર પહોંચશે અને ટ્રેન નંબર ૦૯૦૧૬ સુપરફાસ્ટ સ્પેશલ વડનગરથી ૧७.૨૦ કલાકે ઉપડશે અને 00.૫૫ કલાકે વલસાડ પહોંચશે.

ઉપરોક્ત ટ્રેનોના હોલ્ટના વિગતવાર સમય અને સંરથના માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in જુઓ

ટ્રેન નં. ૧૯૦૦૯ અને ૧૯૦૧૦ નું બુકિંગ તા. ૦૨/૧૧/૨૦૨૨ થી, ૦૯૦૧૫ અને ૦૯૦૧૬નું પ્રારંભિક સેવા માટે બુકિંગ તા. 01/11/२0२२ થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.



અમને કોલો કરો: Twitter.com/WesternRlv

બધી આરક્ષિત ટિકીટો માટે ઓળખપત્ર સાથે રાખો.

એકવાર ફરીથી વધવા લાગ્યા છે. પહેલો કેસ સામે આવ્યો હતો. એક્સબીબી.૩ સબ-વેરિએન્ટના કારણે સિંગાપુરમાં કોવિડ ઓડિશા (૩૫), મહારાષ્ટ્ર (૨૧), સબ-વેરિઅન્ટ ચિંતાનો વિષય છે. ઈન્ફેક્શનમાં ઝડપથી ઉછાળો દિલ્હી (૧૮), પુડ્ચેરી (૧૬), આમાં પણ એક્સબીબી વેરિઅન્ટ આવ્યો છે. ભારત માટે પણ આ કર્જ્ઞાટક (૯), ગુજરાત (૨) અને વધારે ઘાતક છે. જોખમ બનતુ જોવા મળી રહ્યુ છે. રાજસ્થાન (૧) માં પણ દેશના ૯ રાજ્યોમાં અત્યાર સુધી એક્સબીબીનુ સંક્રમણ ફેલાયેલુ છે. એક્સબીબીના કેસ નોંધાયા છે. અત્યાર સુધી મળેલા ૩૮૦ કેસમાં જેમાં તમિલનાડુ સૌથી ઉપર છે.

ઈન્ટરને શનલ ઓર્ગેનાઈઝેશન છે. આ વાયરસમાં ૨.૩૬ ટકા છે. આને જોતા બીજા શકે છે. થનારા પરિવર્તનો પર નજર રાખે રાજ્યોને એલર્ટ કરી દેવાયા છે.

એક્સબીબી.૩ સબ-વેરિઅન્ટ

નવી દિલ્હી, તા.૩૧ ૧૦૩ કેસ સાથે પશ્ચિમ બંગાળ સિસ્ટમને દગો આપીને સંક્રમણનો ઓમિક્રોનના સબ વૈરિએન્ટ બીજા નંબરે છે. બંગાળમાં જ શિકારબની શકે છે. સાથે જ તેમણે એક્સબીબીના કારણે કોરોનાના કેસ - ઓમિક્રોનના આ સબવેરિઅન્ટનો - અમુક દેશોમાં કોરોનાની નવી લહેરની ચેતવણી પણ આપી, તેમણે તમિલનાડુ અને બંગાળ સિવાય કહ્યુ કે કોરોનાના ૩૦૦થી વધારે

> સૌમ્યા સ્વામીનાથને કહ્યુ, આ વેરિઅન્ટ ઈમ્યૂન સિસ્ટમને દગો આપવામાં સક્ષમ છે.

અમે પહેલા પણ કેટલાક ઘાતક જીઆઈએસએઆઈડી એક ૬૮.૪૨ટકાછે. એક્સબીબી.૨ના વેરિઅન્ટ જોયા છે પરંતુ આ રિસર્ચ કેસ ૧૫ ટકા અને એક્સબીબી.૧ના વેરિઅન્ટ એન્ટિબોડી પર હાવી હોઈ

આ વેરિઅન્ટના કારણે અમુક

છે. જે અનુસાર ભારતમાં ૨૩ ડબલ્યુએચઓના ચીફ્ર સાયન્ટિસ્ટ દેશમાં ફરીથી કોરોનાની લહેર

ઓક્ટોબર સુધી એક્સબીબીના સૌમ્યાસ્વામીનાથને પણ કોરોનાના આવી શકે છે. અમે એક્સબીબી ની ૩૮૦ કેસ સામે આવ્યા છે. આ કેસ નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત સાથે-સાથે બીએપ અને બીએ૧ પર તમિલનાડુમાં સૌથી વધુ છે જ્યાં કરી છે. સૌમ્યા અનુસાર પણ નજર રાખી રહ્યા છે. આ બંને ૧૭૫ કેસ નોંધાયા છે. જે બાદ એક્સબીબી વેરિઅન્ટ ઈમ્યૂન વેરિઅન્ટ પણ ખૂબ જ ઘાતક છે.

પુથ્વીના અત્યત નજીકમાથા ઉલ્કાપાડ પસાર થશ વિશાળ એસ્ટેરોઈડ પસારથવાનો દઈએ કે, એસ્ટેરોયડને છે. નાસાના જશાવ્યા અનુસાર, તેની લંબાઈ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા જેટલી છે.નાસાએ તેને સંભવિત રીતે આવે છે. તે ખાસ કરીને સૂર્યની ખતરનાક બતાવ્યું છે. આ એસ્ટેરોઈડનું નામ ૨૦૨૨ RM4 છે. આ ૧ નવેમ્બરના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટસ્ટડીઝઅનુસાર, આ એસ્ટેરોઈડનું અનુમાનિત વ્યાસ ૩૩૦ અને ૭૪૦ મીટરની વચ્ચે અથવા ૨૪૦૦ ફ્રુટથી વધારે છે. આમ જોવા જઈએ તો, વાસ્તવિક અંતર પૃથ્વી-ચંદ્રનું અંતર છ ગણું વધારે હશે, જે કદાચ બહુ નજીક લાગે.આખરે ચંદ્ર પૃથ્વીથી સરેરાશ ૨૩૮,૮૫૫ માઈલ/

નજીકના બિંદુ પરલગભગ ૧.૫ નામ બદલેલ છે

૩૮૪,૪૦૦ કિમી દૂરછે. એટલા

માટે ૨૦૦૨ આરએમ ૪ પોતાના

મેં મારા સગીર પુત્રનું નામ શેખ મોહંમદ અતીફ મોહંમદસોહેલથી બદલીને નવું નામ શેખ આતીફ સોહેલ સરનામુંઃ ૨૭/એ, ન્યુ પ્રેરણા સોસાયટી, વિશાલા હોટલ પાસે, જુહાપુરા, અમદાવાદ-પપ

નામ બદલેલ છે

મારૂ જૂનું નામ સંજીવકુમાર યોગેશકુમાર રાજપુતસિંઘથી બદલીને નવું નામ સંજીવકુમાર યોગેશકુમાર રાજપુત કરેલ છે. ૪, સહયોગ પાર્ક સોસાયટી, નાના ચિલોડા, અમદાવાદ

નામ બદલેલ છે

નામ શેખ મોહંમદસોહેલ મોહસીનભાઈથી બદલીને નવું નામ શેખ સોહેલ મોહસીનભાઈ કરેલ છે. સરનામુંઃ ૨૭/એ, ન્યુ પ્રેરણા સોસાયટી, વિશાલા હોટલ પાસે, જુહાપુરા, અમદાવાદ-૫૫

પૃથ્વીથી અત્યંત નજીક એક કિમી દૂર હશે. આપને જણાવી ઉલ્કાપિંડ પણ કહેવાય છે. એસ્ટેરોયડને કોઈ ગ્રહ અથવા તારાના તૂટેલા ટુકડા માનવામાં ચારે તરફથી સીધી કક્ષામાં આવે છે. ખગોળવીદ દ્વારા ઉલ્કાપીંડ ૨૦૦૨ RM4 નું અનુમાન 360-809 "s/330-740

મિલિયન માઈલ/૨.૪મિલિયન લગાવ્યો છે. તે એટલો ફેલાયેલો હોય શકે છે કે, જે દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. લાઈવસાયન્સના જણાવ્યા અનુસાર, તે લગભગ કલાકની સ્પિડથી પસાર થશે. કોઈ પણ અંતરિક્ષ વસ્તુ જે પૃથ્વીના ૧૨૦ મિલિયન માઈલના દાયરામાં આવે છે, તેને પૃથ્વીની નજીકની વસ્તુ

મીટર પહોંળાઈની વચ્ચે માનવામાં આવે છે.

દિપ એનર્જિ રિસોર્સિસ લિમિટેડ (અગાઉ જાણિતા દિપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

CIN: L63090GJ1991PLC014833 રજી.ઓફીસઃ ૧૨એ અને ૧૪, અભિશ્રી કોર્પોરેટ પાર્ક, આંબલી બોપલ રોડ, આંબલી અમદાવાદ- ૩૮૦૦૫૮. ફોન નં: ૦૨૭૧૭-૨૯૮૫૧૦, ફેક્સ: ૦૨૭૧૭-૨૯૮૫૨૦ ઈ મેઈલઃ info@deepenergy.ooo વેબસાઈટઃ www.deepenergy.ooo

नोटिस (इंपनीना छिडवटी शेरहोस्डर्सना ध्यान भाटे) વિષયઃ કંપનીના ઇક્વિટી શેરનું ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (આઈઈપીએફ ઓથોરિટી)માં ટ્રાન્સફર બાબતે

કંપની એક્ટ, ૨૦૧૩ ની ક્લમ ૧૨૪ (૬) અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા સમયાંતરે સુચવામાં આવતા ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૬ (નિયમો)ની જોગવાઈઓ બનુસાર આ નોટિસ આપવામાં આવી રહી છે. એમસીએ દ્વારા તાજેતરમાં સુચિત કરાયેલા નિયમો અનુસાર, કંપની ના શેરધારકો ના ફિઝીકલ મોડે માં અથવા ડીમેટ મોડેમાં રહેલા રૂ. ૧૦/- ના ઇક્વિટી શેરો કે જુનું સળંગ સાત વર્ષ કે તેથી વધુ સમયથી ડિવિડન્ડ ચૂકવવામાં બાવ્યું નથી અથવા દાવો કરવામાં આવ્યો નથી તેવા શેરો ને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (IEPF ઓથોરિટી)ને ટ્રાન્સફર કરવાની જરૂર છે.

નિયમોમાં નિર્ધારિત વિવેધ આવશ્યકતાઓનું પાલન કરીને, કંપનીએ લાગતા વળગતા શેરહોલ્ડરોને જેમના શેર યોગ્ય કાર્યવાહી કરવા માટે જજ્ઞાવેલ નિયમો હેઠળ આઇઇપીએફ ઓથોરિટીમાં ટ્રાન્સફરને પાત્ર છે,તેમને પત્રો દ્વારા દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવેલ છે.

ચૂકવેલ નથી અથવા દાવો થયેલ નથી તેવા ડિવિડન્ડનો દાવો કરવા માટે લાગતા વળગતા શેરહોલ્ડરોએ તારીખ ૩જી ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, M/s. લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ૫૦૬ થી ૫૦૮, પાંચમે માળ, અમરનાથ બિઝનેસ સેન્ટર-૧ (ABC-૧), ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્નર નજીક, સી. જી. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬, ટેલિફોન અને ફેક્સ નંબરઃ ૦૭૯-૨૬૪૬૫૧૭૯, ઈમેઈલઃ iepf.shares@linkintime.co.in નો સંપર્ક કરી શકે છે.

કૃપા કરીને નોંધ લેશો કે જાહેર કરાયેલ નિયમો અનુસાર, કંપની ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટ(સ) ઈશ્યુ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે અને ત્યારબાદ અસલી શેર સર્ટિફિકેટ(સ) કે જે લાગતા વળગતા શેરહોલ્ડરને નામે નોંધાયેલ છે તે રદબાતલ / બિનવાટાઘાટને પાત્ર રહશે અને આ ઈશ્યુ કરાયેલ ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટ (સ) કોર્પોરેટ એકશન દ્વારા ઇનવેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેકશન ફંડ ઓથોરિટી (IEPF ઓથોરિટી)ની તરફેણમાં શેર જમા કરવામાં આવશે.

સંબંધિત શેરહોલ્ડરો નોંધ લેશે કે, આવી રીતે શેર ફેરબદલી થયા બાદ તેઓ આઇઇપીએફ ઓથોરિટીની પાસેથી ડિવિડન્ડ સાથેના શેરોનો દાવો કરી શકે છે કે જેની માહિતી www.iepf.gov.in પર ઉપલબ્ધ છે.

૭૫ વર્ષ અને તેથી વધુ વચના વરિષ્ઠ-નાગરિકો માટે ખાસ વિન્ડોની સુવિધા આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM) ના ભાગરૂપે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન કંડ ઓથોરિટીએ ૭૫ વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વિન્ડો સુવિધા શરૂ કરી છે. આ સુવિધાના ભાગ રૂપે, કંપનીઓ તરફથી ઈ-વેરિફિકેશન રિપોર્ટ મળ્યા બાદ આ દાવેદારો દ્વારા દાખલ કરવામાં આવેલો દાવો એમસીએ ૨૧

સિસ્ટમમાં ઓટો-પ્રાયોરિટીટાઇઝ્ડ માં આપવામાં આવશે. આ દાવેદારોની સુવિધા માટે, એક ડેડીકેટેડ ટેલિફોન નંબર ૦૧૧-૨૩૪૪૧૭૨૭ અને Email: seniorcitizen.iepfa@mca.gov.in ઉભુ કરવામાં આવ્યું છે. બોર્ડના આદેશ અનુસાર દિપ એનર્જી રીસોંસીસ લિમિટેડ

(અગાઉ જાણિતા દિપ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ) શૈલ સાવલા,મેનેઝિંગ ક્રિરેક્ટર









